

IITGn દ્વારા જે.ઇ.ઇના સ્ટુડન્ટ્સ માટે JEE ઓપન હાઉસ યોજાશે

અમદાવાદ : આઈ.આઈ.ટી. ગાંધીનગર દ્વારા જે.ઇ.ઇ, એડવાન્સના સ્ટુડન્ટ્સને આઈ.આઈ.ટી.ની વિવિધ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં એડમિશન મેળવવા માટે કાઉન્સેલિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગે સ્ટુડન્ટ કોઓર્ડિનેટર સૌરવ નાગરે જણાવ્યું હતું કે આઈ.આઈ.ટી. ના ફેકલ્ટી દ્વારા કેપ: સ્ટુડન્ટ્સને ફી માર્ગદર્શનની સાથે એકોમોડેશન પણ અપાશે.

મુંઝાયેલા સ્ટુડન્ટ્સની મુંઝવણ દૂર કરવા તેમજ તેઓને એન્જિનિયરિંગમાં બેસ્ટ બ્રાન્ચ

સજેસ્ટ કરવા JEE ઓપન હાઉસનું આયોજન કરવામાં આવેલ છે. ઓપન હાઉસમાં માત્ર સ્ટુડન્ટ્સની જિજ્ઞાસાને જ નહીં પરંતુ તેમના પેરેન્ટ્સની આઈ.આઈ.ટી.ને લગતી મુંઝવણ પણ દૂર કરવામાં આવશે. આવનારચાર વર્ષમાં તેમના છોકરાઓ આઈ.આઈ.ટી.માં કેવી રીતનું શિક્ષણ મેળવશે તે અંગે પણ માહિતી અપાશે. સ્ટુડન્ટ કાઉન્સિલના જનરલ સેક્રેટરી પ્રથમેશ બાડવેએ જણાવ્યું હતું કે આ વખતે અમે દૂરથી આવતા સ્ટુડન્ટ્સ માટે ફી એકોમોડેશનની પણ વ્યવસ્થા રાખી છે.

આઈ.આઈ.ટી.એ રાખેલ ઓપન હાઉસમાં આઈ.આઈ.ટી. ગાંધીનગરના ડાયરેક્ટર, ફેકલ્ટી મેમ્બર, એકેડેમિક ડીન્સ અફેર, ડિન ઓફ સ્ટુડન્ટ્સ અફેર, એલ્યુમિનિ, અને આઈ.આઈ.ટી.ના સ્ટુડન્ટ્સ સાથે ઈન્ટરેક્શન યોજાશે. ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તાજેતરમા ઉજી જૂને ઓપન હાઉસ રાખવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર ભાગતમાં સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કરતા આ બીજી વખત આયોજન કરાયેલ છે. જે.ઇ.ઇ. પાસ સ્ટુડન્ટ્સ આઈ.આઈ.ટી.ની વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરાવી શકશે.